

“જે ઓરત પાંચ ટાઈમની નમાઝ પાબંદીથી પઢે, રમઝાન મહીનાના રોઝા રાખે, પોતાની શર્મગાહની હિફઝત કરે અને પોતાના શોહરની ફરમાંબરદારી કરે, તો તે જન્નતના જે દરવાજામાંથી યાહે જન્નતમાં દાખલ થઈ જાય.” (સહીહુલ જામેઅ)

નેક ઓરત

ઈસ્લામિક ઇન્ફર્મેશન સેન્ટર - કચ્છ

હોટલ નુરાની પાસે, ડાંડા બજાર, ભુજ - કચ્છ.

Mo. : 84017 86172 www.iickutch.blogspot.in

નેક ઔરતના ગુણો

નબી સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમનું ફરમાન છે કે, આખી દુનિયા 'મતાઅ' એટલે મિલકત છે અને બહેતરીન મતાઅ નેક ઔરત છે. (મિશકાત) એટલે કે આખી દુનિયા મિલકત અને પૂંજ છે, પરંતુ દુનિયાની તે તમામ ચીજો ફાની છે, ખતમ થઈ જવાની છે. જ્યારે નેક ઔરત દુનિયાની શ્રેષ્ઠ પૂંજ છે. નેક ઔરતના કારણે ઘરની રોનક વધે છે. ઘર, મહોલ્લા સમાજમાં નેક સંસ્કારનું સિંચન થાય છે અને એક સંસ્કારી સમાજની રચના થાય છે.

ઈસ્લામે ઔરતોને ખૂબ જ ઈઝ્ઝત અને ઉચ્ચ દરજ્જા અતા ફરમાવ્યા છે અને નેકીના તમામ કામોના બદલામાં જે અજ્ર અને સવાબ પુરૂષો માટે રાખ્યો છે તે જ ઔરતો માટે પણ રાખ્યો છે. માટે ઔરતોને જોઈએ કે પોતાની અંદર એવા નેક ગુણો પેદા કરે જેના કારણે માહોલ દીનદાર બને અને તેમની પોતાની પણ દુનિયા અને આખેરત સફળ થાય.

૧. નમાઝ રોઝાની પાબંદ :

નેક ઔરતનો આ સૌથી અગત્યનો અને ખાસ ગુણ છે કે તે નમાઝ રોઝાની પાબંદીનો હંમેશા ખયાલ રાખે છે. કેમ કે લાઈલાહ ઈલ્લલ્લાહ અને મુહમ્મદુર્સુલુલ્લાહની ગવાહી આપ્યા પછી એક મુસલમાન ઉપર જે સૌથી મોટી ફરજ લાગુ પડે છે તે પાંચ વખતની નમાઝ છે અને ક્યામતના દિવસે તેના વિષે જ સૌથી પહેલા પૂછપરછ થશે.

(૧) સૌથી અઝ્ઝલ અમલ નમાઝને તેના સમય પર પઢવું છે. (બુખારી)
 (૨) નમાઝ નૂર છે એટલે કે રોશની છે. (મુસ્લિમ) (૩) નમાઝ બેશર્મી અને બુરાઈના કામોથી બચાવે છે. (સુરએ અનકબૂત) (૪) નમાઝ વડે અલ્લાહની મદદ મેળવી શકાય છે. (સુરએ બકરહ) (૫) જો કોઈ વ્યક્તિના ઘર પાસેથી નહેર-નદી વહેતી હોય અને તેમાં તે દિવસમાં પાંચ વખત ગુસલ કરે તો તેના શરીર પર બિલકુલ મેલ બાકી ન રહે, તે જ રીતે પાંચ સમયની નમાઝ માણસના ગુનાહોને મીટાવી દે છે. (બુખારી) (૬) જેણે પાબંદીથી હંમેશા

નમાઝ પઢી તેના માટે આ નમાઝ ક્યામતના દિવસે રોશની, દલીલ અને છુટકારાનું કારણ બનશે. (મુસ્નદ અહમદ)

નમાઝની સાથે સાથે રમઝાન શરીફના ફર્ઝ રોઝા પણ નેક ઓરત પૂરા રાખે છે, વધુમાં સુન્નત રોઝા જેવા કે જિલ હજજના નવ રોઝા, આશુરાના રોઝા, શાબાન મહીનાના શરૂના રોઝા, શવ્વાલના છ રોઝા, દર મહીનાના ૧૩, ૧૪ અને ૧૫ માં ચાંદના રોઝા વગેરે શક્ય હોય ત્યાં સુધી રાખવા આ પણ નેક ઓરતનો ગુણ છે.

નબી સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમનું ફરમાન છે કે, ‘જ્યારે ઓરત પાંચ ટાઈમની નમાઝ પાબંદીથી પઢે, રમઝાન શરીફના રોઝા રાખે, પોતાની શર્મગાહની હિફાઝત કરે અને પોતાના શોહરની ફરમાંબરદારી કરે, તો તે જન્નતના જે દરવાજામાંથી ચાહે જન્નતમાં દાખલ થઈ જાય. (સહીહુલ જામેઅ)

૨. કુર્આન શરીફની તિલાવત :

નિયમિત રીતે કુર્આન શરીફ પઢતા રહેવું તે પણ નેક ઓરતનો ગુણ છે. કુર્આન શરીફના એક હરફ પઢવા પર દશ નેકી મળે છે.

નબી સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ રોજ રાત્રે સૂતા પહેલા સુરએ મુલ્ક અને સૂરએ સજદહ પઢતા. સૂરએ મુલ્ક તેની તિલાવત કરનારને અઝાબે કબ્રથી બચાવશે.

જે ઘરમાં સૂરએ બકરહની નિયમિત તિલાવત થતી હોય તે ઘરમાં શેતાન દાખલ થઈ શકતો નથી.

૩. અલ્લાહનો ઝિક :

હંમેશા અલ્લાહનો ઝિક કરતા રહેવું એ પણ નેક ઓરતનો ગુણ છે. કેમ કે અલ્લાહના ઝિકથી દિલોને સુકુન મળે છે.

હદીષ પ્રમાણે કેટલાક ઝિક :

- (૧) અફઝલ ઝિક ‘લાઈલાહ ઈલ્લલ્લાહ’ છે. (તિરમીઝી)
- (૨) સુબ્હાનલ્લાહિ વલ્હમ્દુલિલ્લાહિ વલા ઈલાહ ઈલ્લલ્લાહુ વલ્લાહુ અકબર.
- (૩) સુબ્હાનલ્લાહિ વબિ હમ્દિહિ સુબ્હાનલ્લાહિલ અઝીમ.
- (૪) લા હલ્લ વલા કુવ્વત ઈલ્લા બિલ્લાહ.
- (૫) લાઈલાહ ઈલ્લા અન્ત સુબ્હાન-ક ઈન્ની કુન્તુ મિન ઝઝાલિમીન.

આ ઉપરાંત ખાતી વખતે, ખાધા પછી, સુતી વખતે, ઉઠતી વખતે,

ઘરમાં દાખલ થતાં, ઘરમાંથી નીકળતા અને બીજી સવાર સાંજની દુઆઓ વગેરે પણ પઢતા રહેવું નેક ઓરતની નિશાની છે.

૪. સુન્નત અને નવાફિલ પઢવાવાળી ઓરત :

ફઝ્લ નમાઝો ઉપરાંત સમયની અનુકુળતા મુજબ બીજી સુન્નત અને નફીલ નમાઝો પઢતા રહેવું પણ નેક ઓરતનો ગુણ છે.

દા.ત. ઈશરાક અથવા ચાશતની નમાઝ, તહજજુદની નમાઝ અને રમઝાનમાં તરાવીહની નમાઝ વગેરે. નબી સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ ફરમાવે છે કે, તે ઓરત ઉપર અલ્લાહની રહમતો ઉતરે છે, જે રાત્રે ઉઠીને તહજજુદની નમાઝ પઢે છે અને પોતાના શોહરને પણ ઉઠાડીને પઢાવે છે.

૫. સદકા ખૈરાત કરવાવાળી ઓરત :

પોતાની હૈસિયત પ્રમાણે અલ્લાહની રાહમાં ખર્ચ કરવું, કોઈ ગરીબને મદદ કરવી વગેરે પણ નેક ઓરતની ખસલત છે. નબી સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમએ ફરમાવ્યું, ‘અચ ઓરતો તમે સદકો ખૈરાત વધુ કર્યા કરો કેમ કે તમે વધારે જહન્નમની ઈંધણ બનવાની છો.’ એટલે કે સદકો ખૈરાત કરતા રહો કેમ કે સદકો અલ્લાહના ગઝબને ઠારી દે છે. આ ઉપરાંત નેક ઓરતે પોતાની પાસેના માલ અને ઘરેણા ઉપર જે ઝકાતની શરતો લાગુ પડતી હોય તો ઝકાત કાઢવી પણ જરૂરી છે.

૬. તૌહીદ ઉપર પાકો અમલ અને દરેક પ્રકારના શિર્કથી બચવું :

નેક ઓરતની આ પણ એક મહત્વની ખસલત છે કે તે તૌહીદની સંપૂર્ણ પાબંદ હોય છે. મુસીબતમાં પોકારે છે તો ફક્ત અલ્લાહને પોકારે છે. પોતાની જરૂરત માંગે છે તો ફક્ત અલ્લાહથી માંગે છે. તે સારી રીતે સમજે છે કે અલ્લાહ સિવાય કોઈ દુઆઓ કબુલ કરનાર નથી, બિમારીમાંથી શિફા આપનાર નથી, અલ્લાહ સિવાય કોઈ મુસીબતો દૂર કરનાર નથી, અલ્લાહ સિવાય કોઈ રોઝીની તંગી દૂર કરનાર નથી. આ વાતને પણ તે સારી રીતે સમજે છે કે અલ્લાહ સુધી આપણી દુઆને પહોંચાડવા માટે કોઈ માધ્યમની જરૂર નથી પણ આવા અકીદાને તે શિર્ક માને છે, જાદુ ટોના કરવાને તે શિર્ક માને છે, તાવીજ-દોરા ઘાગા વગેરેને તે શિર્ક માને છે અહીં સુધી કે અલ્લાહ

શિવાય અન્યની કસમ ખાવી એ પણ શિક્ક છે, આ વાતને તે સારી રીતે જાણે છે. તેને કોઈ દિવસ કોઈ કાહિન, મજુસી, મુજાવર કે બાપુઓ પાસે જવાની જરૂર જ પડતી નથી. એનો આ પાકો અકીદા હોય છે કે ‘હસ્તિબચલ્લાહુ નેઅમલ મોલા વ નેઅમલ વકીલ’ મારા માટે અલ્લાહ પુરતો છે તે બહેતરીન માલિક અને બહેતરીન કારસાઝ એટલે કે કામ કાઢનાર છે.

૭. બાળકોની ઇસ્લામી તરીકા પ્રમાણે સહી તરબિયત કરવી :

નબી સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમનું ફરમાન છે, “ઔરત પોતાના શોહરના ઘરની રખેવાળ અને પોતાની ઓલાદની જીમ્મેદાર છે. કયામતના દિવસે તેને તેની આ જવાબદારી વિષે પૂછવામાં આવશે.” (બુખારી)

એક નેક ઔરત આ વાતનો હંમેશા ખ્યાલ રાખે છે કે તેના બાળકની ફક્ત દુનિયાની જીંદગી બની જાય તે પુરતું નથી, બલ્કે વધારે અગત્યનું તે છે કે તેની આખેરતની જીંદગી પણ બની જાય. આ માટે બાળપણ થી જ તે બાળકમાં ઇસ્લામી સંસ્કારનું સિંચન કરે છે. બાળક બોલતા શીખે તો સૌથી પહેલા તેને દીની કલેમાત બોલતા શીખવાડે છે, સહેજ સમજદારી આવતા તેને ખાવાપીવાના, ઉઠવા બેસવાના, સૂવાના, જાગવાના, પેશાબ પાખાનાના વગેરે બધા જ તરીકા સૂચનત પ્રમાણે શીખવાડે છે. સાથે સાથે સવાર-સાંજ દરમિયાનની જરૂરી દુઆઓ શીખવાડે છે. ઇબ્રત માટે તેને પચગંબરોના અને સહાબાઓના કિસ્સા અવારનવાર સંભળાવે છે. તેને સ્કૂલના ભણતરની સાથે સાથે સારામાં સારા મદ્રસામાં દીની તાલિમ પણ અપાવે છે. તેના પરિણામે તે નેક ઔરતનું બાળક પણ નેક બને છે અને આગળ જતા મા-બાપ ને પજવનારું ન બનતા મા-બાપની આંખોની ઠંડક બને છે.

નબી સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની એક સરસ હદીસ છે કે, “સારા સંસ્કારથી વધારે સારી કોઈ ભેટ કોઈ મા-બાપ પોતાના બાળકને નથી આપતું.”

૮. વધુ સંતાનો પેદા થવાને શર્મ કે આળ નું કારણ ન ગણવું :

નેક ઔરતની એક આ પણ ખૂબી છે કે વધુ બાળકો પેદા થવાને કારણે તે શર્મ કે આળ મહેસુસ નથી કરતી બલ્કે ખુશી મહેસુસ કરે છે અને અલ્લાહનો શુક્ર અદા કરે છે. કેમ કે પ્યારા પચગંબર સલ્લલ્લાહુ અલયહિ વ

સલ્લમની આ વસીયતને તે જાણે છે કે “તે ઔરતોની સાથે નિકાહ કરો જે વધુ બાળકો જણાવાવાળી હોય બેશક હું તમારી મોટી સંખ્યાને કારણે બીજી ઉમ્મતો ઉપર ફૂલ કરીશ.” (અબુ દાઉદ)

૯. દીકરીઓથી મુહબ્બત રાખવી અને રાજીખુશીથી તેમની પરવરિશ કરવી :

હઝરત આયશા રઝિયલ્લાહુ અન્હા બયાન કરે છે કે મારી પાસે એક માંગવાવાળી ઔરત આવી. તેની જોડે તેની બે દિકરીઓ હતી. તે વખતે મારી પાસે તેને આપવા માટે એક ખજૂર સિવાય કંઈ ન હતું. મેં તેને તે ખજૂર આપી દીધી. તે ઔરતે તે ખજૂરના બે ટુકડા કરી પોતાની બંને દીકરીઓને એક એક આપી દીધા, પોતે ન ખાધી. પછી જતી રહી. ત્યાર બાદ નબી સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ જ્યારે આવ્યા ત્યારે મેં આ ઔરતની વાત જણાવી. આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમએ ફરમાવ્યું: “જે વ્યક્તિને દિકરીઓ વડે અજમાવવામાં આવી એટલે કે ઔલાદમાં દિકરીઓ મળી પછી તેણે તે દિકરીઓ સાથે સાડ વર્તન કરી તેમની પરવરિશ કરી, તો ક્યામતના દિવસે તે દિકરીઓ તેના માટે દોઝખથી આડ બની જશે.” (બુખારી)

૧૦. સંતોષ અને શુક ગુજારીનો ગુણ :

નેક ઔરતની એક નેક ખસલત આ પણ છે કે તે જે પણ હાલતમાં હોય તે હાલતમાં સંતોષ માને છે અને અલ્લાહનો શુક અદા કરે છે. અલ્લાહતઆલા ખૂદ કુર્આનમાં ફરમાવે છે: “જો તમે મારો શુક અદા કરશો તો હું તમને વધારે આપીશ અને જો મારી નાશુકી કરશો તો મારો અઝાબ પણ સખત છે.” (સૂરે ઈબ્રાહીમ-૭)

૧૧. હંમેશા પાકી સફાઈ નો ખ્યાલ રાખવો અને ઘરને પણ ચોખ્ખું રાખવું :

નેક ઔરતની આ પણ એક ખાસિયત છે કે તે પાકી સફાઈનો હંમેશા ખ્યાલ રાખે છે. પોતે હંમેશા પાક સાફ રહેવું પસંદ કરે છે, બાળકોને પણ ચોખ્ખા રાખે છે અને ઘરને પણ ચોખ્ખું રાખે છે કેમ કે તે નબી સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમનું આ ફરમાન જાણે છે કે “પાકી અડધુ ઈમાન છે.” (મુસ્લિમ શરીફ)

નેક ઓરત પોતાના કપડા એટલી હદે મેલા થવા દેતી નથી કે સામેવાળાને ધીન આવે. પોતાના નાપાકીના દિવસોથી ફારિંગ થતાની સાથે જ જરાય આળસ કર્યા વગર તરત જ ગુસલ કરી, પાકી હાસિલ કરી લે છે અને પછી નમાઝ રોઝા ઉપર લાગી જાય છે. શોહરને ગમે અને શોહર ખુશ રહે તેવા ચોખ્ખા વસ્ત્રો પહેરે છે. શોહરને માટે જ શાણગાર સજે છે. બાળકોને નિયમિત રીતે નવડાવતી રહે છે અને કપડા બદલાવતી રહે છે. ઘરની દરેક વસ્તુ તેની જગ્યાએ રાખે છે, ઘરની સફાઈ સુથરાઈમાં, કપડા અને વાસણ વગેરે ઘોવામાં અને ઘરના બીજા કામોમાં જરાપણ લાપરવાહી રાખતી નથી. જેને કારણે તેનું ઘર હંમેશા ચોખ્ખું લાગે છે.

૧૨. ઘરમાં ગંદુ લીટરેચર, જાનદાર ચીજોની તસ્વીરો, ગીત સંગીત કે ગંદી ટીવી સીરીયલો ન હોવા જોઈએ :

એક નેક ઓરત કે જે દિવસમાં પાંચ વખતની નમાઝ અદા કરે છે, કુર્આનની નિયમિત તિલાવત કરે છે, ઉઠતા બેસતા અલ્લાહનો ઝિક્ર કરતી રહે છે તે કદીપણ પોતાના ઘરમાં ગંદુ લીટરેચર (અસ્લીલ ફોટાવાળા અને બેકાર મેગેઝીનો, અસ્લીલ ફોટા અને અર્થહીન સમાચારોવાળા દૈનિક પેપરો કે દૈનિક યા અઠવાડિક પૂર્તિઓ અને બેકાર નવલકથાઓ વગેરે) ઘૂસવા દેતી નથી. અને અગર આવી જાય તો તેનો નાશ કરી નાખે છે. જાનદાર (સજીવ) ચીજોના ફોટા ઘરમાં રહેવા દેતી નથી. ફિલ્મી ફહશ ગીત સંગીત, યા બેકાર ટી.વી. સીરીયલોથી બલકે ટી.વી. જોવાથી જ પોતે પણ બચે છે અને પોતાના બાળકોને પણ દૂર રાખે છે. તે જાણે છે કે આ ચીજો એક એવું ખરાબ દુષણ છે કે જેના કારણે બાળકોના ઝહન બુરાઈઓ તરફ અને મા-બાપની નાફરમાની તરફ આસાનીથી ઢળી જાય છે. નબી સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ ફરમાવે છે કે, “બેશક અલ્લાહતઆલાએ શરાબ, જુગાર, સંગીતવાજા, તબલા અને તંબૂરાને હરામ કર્યા છે.” (મુસ્નદ અહમદ) તેમજ ફરમાવ્યું, ‘કોઈ માણસનું પોતાના પેટને પૃ વડે ભરી લેવું બહેતર છે તેના કરતા કે ગંદા શેરશાયરી અને ગીતો વડે ભરે.’ (સહી મુસ્લીમ)

એક નેક ઓરત આ તમામ ચીજોથી બચીને દીની કિતાબો વાંચવાનો શોખ ધરાવે છે અને પોતાનું ઈલ્મ વધે તે માટે અનુવાદવાળુ કુર્આન વાંચે છે

તેમજ નબી સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની હદીષોનો પણ અભ્યાસ કરે છે.

૧૩. નેક ઔરત હંમેશા પતિની ફરમાંબરદાર હોય છે :

નેક ઔરતનો આ પણ એક મહત્વનો ગુણ છે કે તે હંમેશા પતિનું કહ્યું માને છે કેમ કે તે સારી રીતે જાણે છે કે ઔરતની આ એક એવી ફરજ છે કે જેને અદા કરવાથી જન્નત મળે છે અને તેને ચૂકી જવાથી જહન્નમમાં જવું પડે છે. આ બાબતે નબી સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ એ હદીષોમાં ખૂબ જ તાકીદ કરી છે. ફરમાવ્યું છે કે, “જે ઔરત એ હાલતમાં મરે કે તેનો શોહર તેનાથી રાજી હોય તે ઔરત જન્નતમાં જશે.” (તિરમીઝી)

એક નેક ઔરત આ વાત સારી રીતે જાણે છે. તેથી તે પતિનું કહ્યું માની પતિને પણ રાજી રાખે છે અને અલ્લાહને પણ રાજી રાખે છે. હા, પતિ અગર ગુનાહનો કે શરીઅતના ખિલાફ કોઈ કામનો હુકમ કરે તો તે ન માનવો જોઈએ.

૧૪. પોતાની ઈચ્છા અને અસ્મતની દરેક રીતે હિફાઝત કરવી:

નેક ઔરત જે રીતે પોતાના ઘરેલુ મામલાઓમાં શરીઅતની પાબંદ હોય છે તે જ રીતે તે જ્યારે ઘરની બહાર નીકળે છે ત્યારે પણ અલ્લાહના અહકામને ભૂલતી નથી. પોતાના ચહેરાને કદીપણ તે પારકા પુરૂષને કે ગેર મોહરીમને દેખાડવું પસંદ કરતી નથી.

સૌથી પહેલા તો કુર્આનના આ હુકમ કે “તમો પોતાના ઘરોમાં ટકીને બેસી રહો” ઉપર અમલ તરીકે ખાસ જરૂરી કામ વગર કદી ઘરની બહાર નીકળતી નથી. અને જ્યારે નીકળે છે ત્યારે પણ કુર્આનના પરદાના હુકમ પ્રમાણે પોતાના પૂરા બદનને પરદા (આખા બુરખા) વડે ઢાંકીને નીકળે છે. જે નેક ઔરતની ખાસ પહેચાન છે.

૧૫. અન્ય ઔરતો સાથે સારા અખ્લાકથી વર્તવું અને દીનની નસીહત કરવી. :

નેક ઔરતના અખ્લાક પણ ઉમદા હોય છે. સુંદર સ્વભાવ અને વાણી વર્તનને કારણે તે સૌના દિલ જીતી લે છે. જ્યારે પણ કોઈ અન્ય ઔરતથી મુલાકાત થાય તો સલામ કહી મુસાફહ કરે છે. હંમેશા સાચું બોલવું, જુઠ-

ગીબત, યુગલી વગેરેથી પરહેઝ, પડોશીઓ સાથે, સગાવહાલા સાથે સદવર્તન જેવા ઉમદા ગુણોને કારણે તે ઘરમાં, કુટુંબમાં અને મહોલ્લામાં માન અને ઈઝ્ઝત પામે છે. આની સાથે સાથે તે અલ્લાહના દીનની વાતો, નસીહતની વાતો અન્ય ઔરતોને બતાવતી રહે છે અને શાદીના કુરિવાજો, શિર્ક બિદઅતના કામો વગેરેથી તેમને ચેતવતી રહે છે.

૧૬. સીલારહમી અને બુરી સોબતથી પરહેઝ :

જે માણસ અલ્લાહ ઉપર અને આખેરત ઉપર ઈમાન રાખે છે તેણે જોઈએ કે પોતાના સગાવહાલા સાથે નેક સુલુક કરે. (બુખારી)

નેક ઔરત હંમેશા સીલારહમી કરનારી એટલે સગા-સંબંધીઓ સાથે સદતર્વન કરનારી અને રિશ્તેદારી તેમજ સંબંધો ટકાવી રાખનારી હોય છે, તે કોઈની સાથે બોલચાલ બંધ કરતી નથી કે અબોલા કરતી નથી. શોહરનાં દરેક રિશ્તાઓને પોતાના રિશ્તા માને છે. તેના દિલમાં કોઈના માટે કીનો કે કપટ હોતા નથી. આ એક ઉચ્ચ કક્ષાનો ગુણ છે જે બધી ઔરતોમાં હોતો નથી. આ માટે તેને ઘણીવાર સહન પણ કરવું પડે છે, બૂરા વેણ પણ સાંભળવા પડે છે પરંતુ અંતે તેની જ જીત થાય છે અને તેનાથી સંબંધો કાપી નાખનારા પાછા તેની સાથે સંબંધો જોડવા પર મજબૂર થાય છે. અને આ જ સુન્નત તરીકો પણ છે. નબી સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ ફરમાવે છે કે, “ખરી સીલારહમી તે છે કે જે સગાવહાલા આપણી સાથે સંબંધો કાપે તેમની સાથે સંબંધો જોડી રાખવામાં આવે.”

૧૭. મુસીબત ઉપર સબ્રનો ગુણ :

નેક ઔરત જેટલી અલ્લાહથી ડરનારી હોય છે તેટલી જ અલ્લાહ તરફથી તેની અજમાયશ થાય છે. મુસીબત, બિમારી રંજ-ગમ વગેરે દ્વારા અલ્લાહ પોતાની બંદીને અજમાવતો રહે છે. મોમીના ઔરત મુસીબત પર બેબાકળી થઈ જતી નથી. અહીં સુધી કે પોતાના કોઈ સ્વજનનો ઈન્તકાલ થઈ જવા પર પણ સબ્રનું દામન છોડતી નથી. અને તે વખતે નોહા માતમ કરવા, ચીસો પાડવી, છાતી કુટવી જેવા શરીઅત વિરુદ્ધના કામ કરતી નથી.

અગર શોહરનો ઈન્તકાલ થઈ જાય તો સબ્ર કરી શરીઅતના હુકમ મુજબ ચાર મહીના અને દસ દિવસની ઈદ્દત પૂરી કરે છે. અને જો અન્ય કોઈ

સ્વજનનો ઇન્તકાલ થઈ જાય તો ત્રણ દિવસથી વધારે શોક પાળતી નથી. ત્રણ દિવસ બાદ રાબેતા મુજબ જીવન શરૂ કરી દે છે. અહીં સુધી કે ત્રણ દિવસ બાદ નજીકમાં, ઘરમાં કે કુટુંબમાં કોઈ ખુશીનો પ્રસંગ આવતો હોય તો તેમાં પણ કોઈ ફેરફાર કર્યા વગર તેને પણ હસતા મોઢે પૂરો કરે છે.

| ઔરતના બદગુણો |

૧. નમાઝો તર્ક કરવી અથવા નમાઝોમાં સુસ્તી કરવી :

(૧) જે લોકો નમાઝની પાબંદી નથી કરતા તેમના માટે કયામતના દિવસે ન કોઈ જાતનું નૂર હશે, ન દલીલ હશે કે છુટકારો હશે અને તેમનો હશ્ કાફન, ફિરઓન, હામાન અને ઉબય બિન ખલ્ફની સાથે થશે. (મુસ્નદ અહમદ)

(૨) પૈલ (જહન્નમનો એક ખતરનાક ભાગ) છે તે નમાઝીઓ માટે જેઓ પોતાની નમાઝોમાં સુસ્તી કરે છે. (સૂરે માઉન)

૨. લાનતાન કરતા રહેવું :

હંમેશા લાનતાન એટલે કે જુબાનથી અયોગ્ય વાતો બોલતા રહેવું, અપશબ્દો બોલતા રહેવું, ગાળો, ગીબત અને ચાડી ચુગલી વડે ઘરના લોકોને અને અડોશ પડોશ વગેરેને તકલીફો આપતા રહેવું આ બદ ઔરતની નિશાની છે.

નબી સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ પાસે એક ઔરતનું વર્ણન કરવામાં આવ્યું કે, તે ઔરત નમાઝ, રોઝાની પાબંદ છે, સદકો પણ કરે છે, પરંતુ પોતાની જુબાન વડે અડોશ પડોશને ખૂબ જ તકલીફો આપે છે. નબી સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમએ કહ્યું તે “ઔરત જહન્નમી છે.” (અહમદ)

૩. શોહરની નાફરમાની કરવી અને તેને દુઃખ આપવું :

કેટલીક ઔરતોની આ સામાન્ય ખસલતો હોય છે કે શોહરનું કહ્યું નહીં માનવાનું, તેની સામે ઉંચા અવાજે બોલવાનું, તેના એહસાનોનો ઇન્કાર કરવો, તેના પિરૂદ્દ અયોગ્ય ફરિયાદો કરતા રહેવું. આવી ખસલતોને કારણે જ ઘરમાં અવારનવાર ઝગડાઓ થતા રહે છે. નબી સલ્લલ્લાહુ અલયહિ વ

સલ્લમ ફરમાવે છે, “મે જહન્નમમાં વધારે પડતી ઔરતોને જોઈ.” લોકોએ પૂછ્યું” એમ શા માટે ? ફરમાવ્યું, નાફરમાનીને કારણે. પૂછવામાં આવ્યું “અલ્લાહની નાફરમાનીને કારણે?” ફરમાવ્યું, શોહરની નાફરમાની અને એહસાન ફરામોશીને કારણે કે તમો જુંદગીભર એની સાથે ભલાઈ કરો અને કોઈકવાર તમારાથી કોઈ તકલીફ થઈ જાય, તો બોલી ઉઠે છે કે, તમારે ત્યાં તો મેં સહેજ પણ સુખ જોયું નથી. (બુખારી, મુસ્લિમ)

૪. ઘરની અને આપસની ખાનગી વાતો લોકોને કરવાની

ખસલત :

ઔરતની ખરાબ ખસલતોમાંથી એક આ પણ છે કે પોતાના ઘરની, સાસરીની કે અન્ય રાઝની વાતો લોકોની સામે બયાન કરતી ફરે અને કેટલીક ઔરતોમાં એક આ પણ ખરાબ ખસલત હોય છે કે પોતાની મિયાબીવી વચ્ચેની પ્યાર મુહબ્બતની અને અન્ય ખાનગી વાતો સહેલીઓ આગળ બયાન કરે છે, ખ્યાલ રહે આ વાતની હદીષમાં સખ્તીથી મનાઈ કરવામાં આવી છે.

૫. અયોગ્ય બનાવસીંગાર કરવો અને તેના પર ધમંડ કરવાની

ખસલત :

બારીક અને ચુસ્ત લિબાસ પહેરવો જેના કારણે બદનના હિસ્સા જેવી રીતે ઢંકાવવા જોઈએ તે રીતે ન ઢંકાય, ટુંકી બાંચવાળા પહેરણા પહેરવા અને જેના કારણે હાથનો વધુ પડતો હિસ્સો ઉઘાડો દેખાય તેમજ ભ્રમરના વાળ ઉખાડવા, બોચકટ વાળ કરાવવા, વાળ કાળા કરાવવા ઉપરાંત વધુ પડતો બિન જરૂરી મેકઅપ અને બનાવ સિંગાર કરવો, આ બધાજ ઔરતોના અવગુણો છે કે જેની હદીષમાં મનાઈ કરવામાં આવી છે.

(૧) હઝરત આયશા રઝિયલ્લાહુ અન્હા જણાવે છે કે, એક વખત હઝરત અસ્મા રઝિયલ્લાહુ અન્હા નબી સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની પાસે આવી. તે વખતે તેના બદન ઉપર બારીક કપડા હતા. આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમએ તેને જોઈને તેનાથી પોતાનો ચહેરો ફેરવી લીધો અને ફરમાવ્યું: “અય અસ્મા જ્યારે ઔરત બાલિગ થઈ જાય તો તેના ચહેરા અને હથેળી સિવાય (ઘરની અંદર) બદનનો કોઈ હિસ્સો દેખાવવો ન જોઈએ.”

(અબુદાઉદ)

(૨) ખૂશ્બૂ લગાવીને મરદોની વચ્ચેથી પસાર થનાર ઓરતને નબી સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમએ સખત શબ્દોમાં વખોડી છે.

(૩) વાળ કાળા કરાવવાની ખસલત : કેટલીક ઓરતો પોતાની વધતી ઉંમરને છુપાવવા વાળને કાળા કરે છે જે માટે નબી સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમએ ફરમાવ્યું: “મારી ઉમ્મતમાં છેલ્લા જમાનામાં કેટલાક લોકો આવશે જે કાળા રંગ વડે પોતાના વાળોને રંગશે જેમ કે કબૂતરના પીંછા હોય. તેઓ જન્નતની ખૂશ્બૂ ન સુંઘશે ન પામશે.” (અબુદાઉદ) વાળમાં મહેંદી લગાવવું સુન્નત છે.

(૪) નખ લાંબા કરવા અને તેના ઉપર નેલ પોલીશ લગાવવી : આમ કરનાર ઓરતોને આ વાતની ખબર નથી કે જ્યારે તે નમાઝ માટે વઝુ કરશે તો નેલ પોલીશને કારણે નખ ઉપર પાણી નહીં પહોંચે અને તેથી વઝુ પુરૂ થયું નહીં કહેવાય જેને કારણે નમાઝ પણ નાકિસ રહેશે. (નિદાએ હક)

(૫) બ્યુટી પાર્લરોમાં જવાની આદત: આ નવા જમાનાની એક નવી ફેશન છે. જેમાં પૈસા પણ વેડફાય છે અને અહીં કરાવવામાં આવતો મોટાભાગનો બનાવસીંગાર નાજાઈઝ હોય છે. આ પણ એક બૂરી ખસલત છે.

(૬) બનાવટી વાળ લગાવવાવાળી ઓરત વિષે નબી સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમએ ફરમાવ્યું: “વાળમાં નકલી વાળ જોડવાવાળી અને છુંદણા છુંદાવવાવાળી ઓરતો પર અલ્લાહ લાનત કરે છે.

૬. બેપર્દગી એકદમ બૂરી ખસલત છે :

રસુલુલ્લાહ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમએ ફરમાવ્યું કે “ઓરત સંપૂર્ણ પરદો છે” (તિરમીઝી)

એટલે કે ઓરત શબ્દનો અર્થ જ પરદો થાય છે અને ઓરતે પોતાનું શરીર માથાથી પગ સુધી પરદામાં રાખવું જરૂરી છે.

(૧) કુર્આનમાં અલ્લાહ ત્આલા ફરમાવે છે, “મોમીન સ્ત્રીઓને કહી દો કે પોતાની નજરોને નીચે રાખે અને પોતાની શર્મની જગ્યાઓની હિફાઝત કરે અને પોતાની ઓઢણીઓને પોતાની છાતીઓ પર નાખેલી રાખે અને પોતાના શોભા-શણગારને જાહેર ન કરે.” (૩૧, સૂરે નૂર)

(૨) અથ નબી, આપ પોતાની પત્નીઓને, પોતાની દિકરીઓને અને

તમામ મુસલમાન ઓરતોને જણાવી દો કે પોતાના ચહેરાઓને પોતાની ચાદરોના પાલવ વડે ઢાંકેલા રાખે. (સૂરે અહઝાબ)

(૩) બનાવસિંગાર કરી લોકોને પોતાની તરફ આકર્ષવાના હેતુથી બે-પર્દા થઈને બહાર નીકળવાવાળી ઓરત કે જે પોતાની તરફ લોકોને આકર્ષવાવાળી હશે અને પોતે લોકોની તરફ આકર્ષાશે, આવી ઓરતો જન્નતમાં દાખલ નહીં થાય અને ન તો જન્નતની ખૂશ્બૂ પામશે, જ્યારે કે જન્નતની ખૂશ્બૂ ખૂબ જ દુરથી આવે છે. (મુસ્લિમ)

૭. ઝીનાકાર ઓરતો :

સ્વચ્છ સમાજનું એક સૌથી ખરાબ દુષણ એવા મર્દ અને ઓરતો છે જેઓ કુદરતના અને સમાજના કાનૂનને હુકરાવી એકબીજા સાથે અનેતિક સંબંધો બાંધે છે ચાહે તેઓ અપિવાહિત હોય ચા પિવાહિત. કુર્આને આવા મર્દ અને ઓરતને હદથી વધી જનારા કહ્યા છે. અને હદીષોમાં આવા મર્દ અને ઓરત માટે જેઓ પોતાના આ ગંદા કૃત્યથી તોબા ન કરે તો જહન્નમના તન્નૂરમાં ભડભડ સળગવાની સજા પામનારા કહ્યા છે.

૮. નજરબાજી અને નાજાઈઝ સંબંધો રાખવાની બૂરી

ખસલત :

કેટલીક ઓરતોને પરાયા મર્દો સાથે નજરબાજી લડાવવાનો શોખ હોય છે જે નિહાયત બૂરી ખસલત છે. હદીષમાં આ બૂરી ખસલતને ઝિનાકારીનો એક પ્રકાર જ ગણવામાં આવ્યો છે.

(૧) નબી સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ ફરમાવે છે કે, ‘આંખો ઝિના કરે છે અને આંખોનું ઝિના (ઐર મર્દને) જોવું છે.’

(૨) ફરમાવ્યું ! જોવાવાળા અને જેની તરફ જોવામાં આવે છે તે બન્ને ઉપર અલ્લાહની લાનત છે. (મિશકાત)

આ નજરબાજીને લઈને જ કામ આગળ વધે છે અને તે ધીમે ધીમે ખોટા સંબંધોમાં પરિણમે છે. ખાસ કરીને ભોળી જવાન છોકરીઓ પ્યાર મોહબ્બતના નામે નાજાઈઝ સંબંધો અને લફરાઓમાં ફસાઈ જાય છે અને તેમાં બદનામ થવાથી કેટલીક વખતે જીંદગીભર વેઠવું પડે છે. આવા લફરાના સંબંધો રાખવા એક ફેશન અને ગર્વની વાત થઈ ગઈ છે બલ્કે વધારે શર્મની

વાત તો એ છે કે શાદીશુદા છોકરીઓ પણ આવા નાજાઈઝ સંબંધો શોખ ખાતર રાખતી થઈ ગઈ છે. આ એકદમ ગંદી અને બૂરી ખસલત છે. સમજદાર અને દીનદાર ઓરતોએ આનાથી બચવું જોઈએ.

૯. ગૈર મર્દો સાથે છૂટથી વાતચીત કરવી તેમજ નરમ લહેજથી વાતો કરવી એ પણ બૂરી ખસલત છે. :

ઈસ્લામ ઓરતને સંપૂર્ણ સુરક્ષાની તાલિમ આપે છે કે કોઈ પારકા મર્દ સાથે નરમ લહેજથી વાત પણ ન કરો કે જેથી કોઈ દિલનો મરીજ ગલત ખયાલ કરી બેસે અને તમને પરેશાન કરે. પોતાના ભાઈના દોસ્તો સાથે, શોહરના દોસ્તો સાથે, અન્ય ઓળખાણ સંબંધોવાળા સાથે, કોઈ ચીજ ખરીદતી વખતે કોઈ દુકાનદાર કે કોઈ ફેરિયા સાથે વગેરે દરેક ગૈર મોહરીમની સાથે ઈસ્લામે નરમ લહેજથી કે છુટછાટથી વાત કરવાની મનાઈ કરી છે. આવી ખસલત ઓરતોની બૂરી ખસલત ગણાય છે.

૧૦. કુઝુલ ખર્ચાની બૂરી ખસલત :

મોજશોખની એવી આદત રાખવી જેમ કે :

(૧) અવારનવાર બિનજરૂરી કપડા ખરીદવા, ઘરમાં બિનજરૂરી સજાવટની ચીજો ખરીદવી, હરવા ફરવાના ખોટા શોખ રાખી પૈસા વેડફવા.

(૨) શાદી વિવાહ કે અન્ય કોઈ પ્રસંગમાં ખોટા દેખાડા અને ખોટી જાહોજલાલી કે ઝાકઝમાળ કરવાનો આગ્રહ રાખવો. નવા નવા કુરિવાજો પાછળ બેફામ પૈસા ખર્ચવા, ફોટોગ્રાફી-વિડિયોગ્રાફી કરાવવી આ બધું કરવા શોહરને મજબૂર કરવો.

આ એવી બૂરી ખસલતો છે કે જે ખસલત ધરાવનારાઓને કુર્આને “શયતાનના ભાઈ” કહ્યા છે.

૧૧. હમલના રહી જવામાં રૂકાવટ કરવી અથવા હમલને તોડી નખાવવો :

ઓરતોમાં રહેલી આ એક મોટી ગુનાહિત માનસિકતા છે અને અલ્લાહની નજરમાં કબીરા ગુનાહ છે. કેટલીક મુસલમાન ઓરતો ઓલાદ પેદા ન થાય, ગર્ભ ન રહે તે માટે ખોટા રસ્તા અપનાવે છે તેમજ રહી ગયેલા ગર્ભને એટલે કે પેટમાં રહેલા જીવને આધુનિક કોઈપણ રીતે પડાવી નાખે છે એટલે કે

એક જીવની હત્યા કરે છે. કુર્આન કહે છે: ‘પોતાની ઓલાદને રોજીના ડરથી કતલ ન કરો અમે તમને પણ રોજી આપીશું અને તે ઓલાદને પણ.’

(સૂરે અન્આમ - ૧૫૧)

આ હત્યા કરનારા મર્દ-ઔરતોની કયામતના દિવસે શી હાલત થશે જ્યારે એ નિર્દોષ બાળકીને જેના ગર્ભને તેમણે કતલ કરાવી નાખ્યો હશે પૂછવામાં આવશે “બિ અચિય ઝમ્બિમ કુતિલત” ‘એટલે કે, તારો શું વાંક હતો કે (તારા મા-બાપે) તને કતલ કરી નાખી? (સૂરે તકવીર)

અલ્લાહ ત્આલા આપણા સૌની અંદરથી તેને ના પસંદ હોય તેવા દુર્ગુણો દૂર કરે અને આપણને સૌને આપણી અંદર નેક ગુણો પેદા કરવાની તોફીક અતા ફરમાવે. આમીન.

(સાભાર : દાવતે હક કમિટી, નડીઆદ)



અપીલ

અલ્હમ્દુલીલ્લાહ, ઇસ્લામીક ઇન્ફર્મેશન સેન્ટર-ભુજની સ્થાપના ૨૦૧૨ ના વર્ષમાં થઈ હતી. તેનો હેતુ અલ્લાહના દીનથી અજાણ લોકો સુધી ઇસ્લામનો સંદેશ પહોંચાડવાનો છે. સંસ્થા દીનની દાવત માટે જે કંઈ કરી રહી છે તેની માહિતી આપ સૌ સુધી પુસ્તકોના માધ્યમથી પહોંચતી રહી છે. આપ જાણો છો કે દીની સાહિત્ય છપાવવા માટે વિશેષ આયોજન અને નાણાકીય ભંડોળની જરૂર રહે છે. આ સંદર્ભમાં આપને તન-મન અને ધનથી સંસ્થાને સહકાર આપવાની નમ્ર અપીલ કરીએ છીએ.

कुर्आन का पैगाम आप के नाम

- ◆ उस से ञालीम कौन है ञसे अल्लाह की आयतें दीजाई जाये और वोह उसे ना माने. (सुर: कहफ़-१८, ५७ - सुर: जासिया-४५, ५-८)
- ◆ अल्लाह को छोडकर उसके बंदों को मत पुकारो.
(सुर: आराफ़-७, १८४-१८७ - सुर: युनुस-१०, २८-३५ - सुर: नहल-१५, २०-२१ - सुर: कहफ़-१८, १०२)
- ◆ अल्लाह शीर्क करने वालो को कभी माफ़ नही करेगा.
(सुर: नीसा-४, ४८, ११५)
- ◆ अकसर लोग ईमान लाने के बाद भी शीर्क करते हैं.
(सुर: युसुफ़-१२, १०५)
- ◆ अगर कोई नबी भी शीर्क करता तो उसके आमांल भी बरबाद हो जाते. (सुर: अनआम-५, ८३-८८ - सुर: ईसरा-१७, ३८ - सुर: जुमर-३८, ५५)
- ◆ सीर्क अल्लाह से ही दुआ मांगो और वही दुआ कबुल करनेवाला है.
(सुर: बकर:-२, १८५ - सुर: ईब्राहीम-१४, ३८ - सुर: गाईर-४०, ५० सुर: शूरा-४२, २५-२५)
- ◆ सब के सब अल्लाह के सामने झकीर और मुहताज हैं.
(सुर: झातीर-३५, १५)
- ◆ मुई या जो कबरोमे हैं, सुन नही सकते.
(सुर: नमल-२७, ८० - सुर: झातीर-३५, २२)
- ◆ कीयामत के दीन अपनी मरज़ी से कोई कीसीकी सीझारीश नहीं कर पायेगा. (सुर: बकर:-२, २५५ - सुर: अनआम-५, ५१,७०,८४ सुर: युनुस-१०, ३ सुर: मरीयम-१८, ८७)
- ◆ गैब का ईल्म शीर्क अल्लाह के पास है.
(सुर: आलेईमरान-३, १७८ - सुर: माईदा-५, ११५ - सुर: अनआम-५, ५८ सुर: हूद-११, १२३)

- ◆ **कीसी नबी को भी गैब का र्दलम नहीं था.**
(सुर: मारुदल-ड, १०ॢ, ११ॡ-११ॣ - सुर: हूँ-११, ॢड-ॣ१)
- ◆ **मुहम्मद (सल्लल्लाहु अलयहि व सल्लम) भी गैब नहीं जानते थे.**
(सुर: आलेरुडरान-ॣ, ॡॡ - सुर: अनआम-ॡ, ड० - सुर: आररु-ॣ, १ॢॢ सुर: अनरुल-ॢ, ॡ०)
- ◆ **अल्लाह अपने रसूलोंमें से ँसको ँतना याहता है गैब का र्दलम अता कर देता है.** (सुर: आलेरुडरान-ॣ, १ॣॢ - सुर: ँन-ॣॢ, ॢॡ-ॢॣ - सुर: हूँ-११, ॡॢ - सुर: युसुरु-१ॢ, १०ॢ)
- ◆ **मुहम्मद (सल्लल्लाहु अलयहि व सल्लम) ँुद अपने ड़ायदे और नुकसानका कोरु र्दुडतीयार नहीं रडते थे.** (सुर: आररु-ॣ, १ॢॢ)
- ◆ **सारे रसूल डशर (रुनसान) थे.** (सुर: हूँ-११, ॢड-ॢॣ - सुर: रुडुरररुडररु-१ॡ, १०-११ - सुर: मुअुडुन-ॢॣ, ॢॣ-ॢॡ, ॣॢ-ॣॡ, सुर: हॡॡ-ॢॢ, ॣड)
- ◆ **नबी (सल्लल्लाहु अलयहि व सल्लम) भी अेक डशर और रसूल थे.**
(सुर: रुसरर-१ॣ, ॢ०-ॢॡ - सुर: कहरु-१ॢ, ११० - सुर: मुअुडुन-ॢॣ, ॣ सुर: कुसरुलत-ॡ१, ॡ)
- ◆ **अल्लाह और उसके रसूल के मुक़ाडलेमें डाप, दलदल और डुडुगुगे के डीछे मत डलो.** (सुर: डकर-ॢ, १ॣ० - सुर: मारुदल-ड, १०ॡ - सुर: लुकडरन-ॣ१, ॢ१- सुर: अहरुडरन-ॣॣ, ॡॡ-ॡॢ)
- ◆ **सीरु गुडरन और अदकलो के डीछे मत डलो.** (सुर: अनआम-ॡ, १ॢॢ)
- ◆ **अकसरुडत के डीछे मत डलो.**
(सुर: अनआम-ॡ, ११ॡ - सुर: आररु-ॣ, ॣ, ॣ०-ॣ१)
- ◆ **रसूलुल्लाह (सल्लल्लाहु अलयहि व सल्लम) की र्दताअत ही नीजत का डहेतरुन डरुडरु है.** (सुर: आलेरुडरान-ॣ, १ॢ, ॣ१-ॣॢ, - सुर: नीसर-ॡ, ॡॢ, ॡॡ-ॡड, ॡॢ, ॢ०, ११ड - सुर: मारुदल-ड, ॢॢ - सुर: अनरुल-ॢ, ॢ०)
- ◆ **जे अल्लाह और उसके रसूल दे डस उसडे ही ररुडी रहे.**
(सुर: अहरुडरन-ॣॣ, ॣॡ - सुर: हॡॢ-ॡॢ, ॣ)

હિજાબ સચી રીત

“અને ફરમાવી દો મોમિન સ્ત્રીઓને કે પોતાની નજરોને નીચી રાખે અને પોતાની શર્મગાહોની રક્ષા કરે અને પોતાની ઝીનત (શાણગાર) ને જાહેર ન કરે, સિવાય એ જે તેમાંથી જાહેર થઈ જાય (જેનું જાહેર થઈ જવું અનિવાર્ય હોય, જેમ કે બે આંખો) અને તે પોતાની ઓઢણીઓ છાતીઓ પર નાખી રાખે અને પોતાના સૌંદર્યને જાહેર ન કરે...”
(કુર્આન, સૂર: નૂર, આ. ૩૧)

“હે નબી (સ.અ.વ.) તમે તમારી પત્નીઓને અને પુત્રીઓને અને મોમિન સ્ત્રીઓને ફરમાવી દો કે તેઓ પોતાના ઉપર પોતાની ચાદરો નાખી રાખે, આ તેમના માટે વધારે સારું છે કે જેથી તેમની ઓળખ થઈ જાય અને તેમને સતાવવામાં ન આવે.”
(કુર્આન, સૂર: અહઝાબ, આ. ૫૯)

હિજાબના આદેશો - કુર્આન અને હદીષમાં :

હિજાબ સુશોભિત-શાણગારેલ ન હોવો જોઈએ. (સૂર: નૂર, આ. ૩૧)


હિજાબનું કાપડ જાડું હોવું જોઈએ, પારદર્શક કે આરપાર દેખાય એવું ન હોવું જોઈએ. (સહીહ મુસ્લિમ, હ.નં. ૨૧૨૮)

હિજાબ ઢીલો-મોકળો હોવો જોઈએ, તંગ ન હોવો જોઈએ કે શરીરનો આકાર દેખાય. (મુસ્નદ અહમદ, બયહકી)

હિજાબ પ્રસિદ્ધિ અને ઘમંડ માટે ન હોવો જોઈએ. (હિજાબ અલ-મરઅહ અલ-મુસ્લિમહ, પૃ. ૫૪-૬૭)

ઊંટની ખૂંધ જેવી હેર-સ્ટાઈલની મનાઈ છે. (સહીહ મુસ્લિમ, હ.નં. ૨૧૨૮)

હિજાબ પુરુષના પોશાક જેવો ન દેખાવો જોઈએ. (સહીહ બુખારી, હ.નં. ૫૮૮૫)



બજારમાં આજકાલ ઘણા પ્રકારના બુરખા મળે છે, પરંતુ તે યોગ્ય ઈસ્લામી પોશાકને અનુસાર નથી. ઈસ્લામી પોશાક સ્ત્રીના શરીરને સંપૂર્ણપણે છુપાવે છે અને સુરક્ષા આપે છે. આજે બજારમાં જે બુરખા જોવા મળે છે તે ટૂંકા, મોન્ટો (ઈરાની કોટ), ટાઈટ, એમ્બ્રોઈડરી કરેલા હોય છે. એમ્બ્રોઈડરી મોટાભાગે કમર, છાતી અથવા પીઠના ભાગ પર હોય છે. હેડ સ્ટાઈ, જે વાળને ટાઈટ કરી નાખે છે અને દેખાવમાં ઊંટની ખૂંધ જેવું દેખાય છે...

યાદ રહે-આ પ્રકારના બુરખા / હિજાબ પહેરવા બિનઈસ્લામી છે.